

વિના મૂલ્યે



ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન

બિરસા મુંડા ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

ફોન નં ૦૭૯-૨૩૨૫૩૮૪૬ <http://adijatinigam.gujarat.gov.in>

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન પાસેથી સ્વરોજગારી તેમજ એન.એસ.એફ.ટી.ડી.સી, ન્યુ દીલ્હી યોજના હેઠળ વ્યક્તિગત ધોરણે જુદા જુદા વાહનની લોન મેળવવા માટેની અરજી ફોર્મ:-

વિદેશ અભ્યાસ ☐ પાયલોટ તાલીમ ☐ વકિલ સહાય ☐ સ્વરોજગારી ☐ પોલ્ટી ફાર્મ ☐
વાહનનો પ્રકાર:- રીક્ષા ☐ ઇકોવાન ☐ ટ્રેક્ટર વીથ ટ્રોલી ☐ પીક-અપ વાન ☐ કુડવાન ☐ હસ્તકલાના આર્ટિસ્ટો ☐

અરજદારનો
તાજેતરનો
ફોટો અહીં
ચોટાડવો

કચેરીનો નોંધણી નંબર /તારીખ :-

અરજદારનો ફોન નં:-

(૧) અરજદારની વિગત.

(અ) અરજદારનું પુરેપૂરું હાલનું નામ/સરનામું :-
(અટક પ્રથમ લખવી).

(બ) કાયમી(વતનનું) સરનામું:મુ.....પો.....
તા.....જી.....પી.કો.નં.....

(ક) ઉંમર: જન્મ તારીખ: (આધાર કાર્ડની નકલ રજૂ કરવી)

(ડ) અરજદાર અનુસુચિત જનજાતિનાં છે.તે :
મતલબનો જાતિનો દાખલો બીડવો.
(મદદનીશ કમિશ્નર (આદિજાતિ) અથવા સક્ષમ અધિકારી)
(ઇ) અભ્યાસ (માર્કશીટની નકલ રજૂ કરવી) :

નીચે જણાવેલ કોષ્ટકમાં વકીલ સહાયના અરજદારે વિગતો ભરવી. (કોષ્ટક-૧)

પદવી	વિષય	યુનિવર્સિટી	પાસ કર્યાનો માસ/વર્ષ	રેન્ક/ગ્રેડ/ટકાવારી
L.L.B/L.L.M (જુનિયર વકીલ)				
L.L.B/L.L.M (સિનીયર વકીલ)				

નીચે જણાવેલ કોષ્ટકમાં વિદેશ અભ્યાસ/પાયલોટ તાલીમના અરજદારે વિગતો ભરવી. (કોષ્ટક-૨)

વિગત	વિષય (આર્ટ્સ/સાયન્સ/કોમર્સ)	યુનિવર્સિટી (અભ્યાસની વિગત)	પાસ કર્યાનો માસ/વર્ષ	રેન્ક/ગ્રેડ/ટકાવારી
કોઇ પણ ડીગ્રી				
વિદેશ અભ્યાસ/પાયલોટ તાલીમ માટે ક્યાં પ્રવેશ મેળવેલ છે?				
કોર્સની વિગત				
યુનિવર્સિટીનું નામ-સરનામું				
ફીની વિગત				

(૨) (ક) હાલનાં ધંધાની વિગત :

(ખ) અરજદારની મિલકત અંગે ની વિગત : સર્વે નં:-..... ખાતા નં:-..... ક્ષેત્રફળ:-..... અંદાજિત કિંમત.....

અરજદારે રજૂ કરેલ મિલકત ખેતીની જમીન/પ્લોટનો એરિયા જેમાં બાંધકામનો વિસ્તાર બાંધકામ સિવાયનો ખૂલ્લો વિસ્તારની વિગત..... ક્ષેત્રફળ:-..... સહિત અંદાજિત કિંમત સાથે દર્શાવવાની રહેશે.

(૭/૧૨ અને ૮અના ઉતારા અથવા પ્રોપર્ટી કાર્ડની નકલ સામેલ કરવી તેમજ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરવો જેમાં મિલકતની અંદાજિત કિંમત રજૂ કરવી) મિલકતની સ્થિતિ પાકું મકાન, ખેતર, ખૂલ્લો પ્લોટ

(ગ) બોજાની વિગત:-હા કે ના?:- જો હા તો કેટલી રકમનો બોજો મિલકત ઉપર નોંધાયેલ છે? તેની વિગત/રદ કરેલ હોય તો તેની વિગત આપવી:-

(૩) લાભાર્થીએ લીધેલ કરજની વિગત અરજદારે દુધ મંડળી, સેવા મંડળી કે અન્ય સ્થાનિક મંડળી નાણાકિય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવેલ હોય તો મુદત વીતી બાકીદાર ન હોવા બાબતે જે તે સંસ્થાને દાખલો રજૂ કરવાનો રહેશે.

(૪) લોનની વિગત :

(ક) લોન માંગણીનો હેતુ :

(ખ) લોન માંગણીની રકમ રૂ. :

(ગ) ધંધાનું સ્થળ અને તેનો આધાર તેમજ જરૂરી લાયસન્સ તથા અનુભવની વિગત પુરાવા સહીત રજૂ કરવી

(૫) અરજદારે છેલ્લા પાંચ વર્ષમાં અન્ય સંસ્થા/બેંકમાંથી લીધેલ હોય તો લોનની વિગત: (દાખલો રજૂ કરવો)

(૬) અરજદારના કુટુંબીજનોએ છેલ્લા પાંચ વર્ષમાં વર્ષમાં અન્ય સંસ્થા/બેંકમાંથી લીધેલ હોય તો લોનની વિગત : (દાખલો રજૂ કરવો)

(૭) જામીનની વિગત :

(જામીનદારનું પુરેપુરું નામ અને સરનામું તેમજ ફોટો) (અટક પ્રથમ દર્શાવવી)

(૧) નામ.....મુ.....પો.....

તા.....જી.....પી.કો.નં.....

જામીનનો ફોન નંબર:-

જામીનદારની સહી/અંગુઠાનું નિશાન.....

જામીનદાર-૧ની મિલકતની વિગત:- સર્વે નં:-..... ખાતા નં:-..... ક્ષેત્રફળ:-.....

જામીનદાર-૧એ રજૂ કરેલ મિલકત ખેતીની જમીન/પ્લોટનો એરિયા જેમાં બાંધકામનો વિસ્તાર

બાંધકામ સિવાયનો ખૂલ્લો વિસ્તારની વિગત..... ક્ષેત્રફળ:-..... સહિત અંદાજિત કિંમત સાથે દર્શાવવાની રહેશે.

(૭/૧૨ અને ૮અના ઉતારા અથવા પ્રોપર્ટી કાર્ડની નકલ સામેલ કરવી તેમજ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરવો જેમાં

મિલકતની અંદાજિત કિંમત રજૂ કરવી)

જામીનદાર-૧
નો તાજેતરનો
ફોટો અહીં
ચોટાડવો

(૨) નામ.....મુ.....પો.....

તા.....જી.....પી.કો.નં.....

જામીનનો ફોન નંબર:-

જામીનદારની સહી/અંગુઠાનું નિશાન.....

જામીનદાર-૨ની મિલકતની વિગત:-સર્વે નં:-..... ખાતા નં:-..... ક્ષેત્રફળ:-.....

અરજદારે રજૂ કરેલ મિલકત ખેતીની જમીન/પ્લોટનો એરિયા જેમાં બાંધકામનો વિસ્તાર બાંધકામ સિવાયનો ખૂલ્લો

વિસ્તારની વિગત..... ક્ષેત્રફળ:-..... સહિત અંદાજિત કિંમત સાથે દર્શાવવાની રહેશે.

(૭/૧૨ અને ૮અના ઉતારા અથવા પ્રોપર્ટી કાર્ડની નકલ સામેલ કરવી તેમજ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરવો જેમાં

મિલકતની અંદાજિત કિંમત રજૂ કરવી)

જામીનદાર-૨
નો તાજેતરનો
ફોટો અહીં
ચોટાડવો.

(૮) બાંહેધરી:- આથી હું પ્રમાણિત કરું છું કે, ઉપરની માહિતી મારી જાણ મુજબ સાચી છે; અને માહિતીના આધારે કોર્પોરેશન પોતાના અધિકારની રૂએ..... ના હેતુ માટે ધિરાણ મંજૂર કરશે તે અંગેની ફોર્મની શરતો આ સાથેના પત્રકમાં જણાવ્યા પ્રમાણે વર્તવા આથી હું બંધાઉં છું. વધુમાં આ ધિરાણની રકમ પુરેપુરી ભરપાઇ ના કરું ત્યાં સુધી બીજા કોઇપણ પાસેથી આ જ હેતુ માટે કરજ લઇશ નહીં, તેની બાંહેધરી આપું છું. લોન ભરપાઇ ના થાય ત્યાં સુધી મિલકતનો વીમો ઉતારાવી, મેળવેલ ધિરાણ પુરેપુરું ચુકતે ન કરું ત્યાં સુધી, કોર્પોરેશનની સંમતિ બહાર તબદીલી કે વેચાણ નહીં કરવાની બાંહેધરી આપું છું. કોર્પોરેશનના વસુલાતના હપ્તા નિયમિત ન ભરું તો ધિરાણથી ખરીદવામાં આવેલ મિલકતનો કોર્પોરેશન કબજો લઇ, વેચાણ કરી ધિરાણની વસુલાત વ્યાજ સાથે વસુલ કરવાની બાંહેધરી આપું છું.

સ્થળ:-

તારીખ:-

સાક્ષીની સહી

અરજદારની સહી.

અથવા અંગુઠાનું નિશાન.

(૯) તાલુકા વિકાસ અધિકારી/ જીલ્લા ખેતીવાડી અધિકારી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર/અન્ય સહાય આપનાર કચેરીએ આપવાનો દાખલો. (આ દાખલો સબસીડી મેળવવા ઇચ્છતા લાભાર્થીએ રજૂ કરવાનો રહેશે.)

આથી દાખલો આપવામાં આવે છે કે, અરજદારની અરજીમાં કુલ વાર્ષિક આવક સહિત તમામ ફકીકત બરાબર અને સાચી હોવાની ખાત્રી કરવામાં આવે છે, અને અરજીમાં દર્શાવેલ ધિરાણ મંજૂર કરવા અંગેની ભલામણ કરવામાં આવે છે. તથા આ અરજીમાં દર્શાવેલ ધિરાણ અંગે આ અરજદારને વધુમાં વધુમાં રૂ. (અંકે રૂપિયા.....)ની રકમ. યોજના હેઠળ સહાય પેટે મંજૂર કરવાપાત્ર છે. અને તે મુજબ મંજૂર કરવામાં આવશે.

સ્થળ

તારીખ:-

(કચેરીનો સિક્કો લગાડવો)

તાલુકા વિકાસ અધિ/જીલ્લા ખેતીવાડી
અધિકારી/જીલ્લા મત્સ્ય અધિકારી/અન્ય કચેરી

(૧૦) પ્રોજેક્ટ એડમીનીસ્ટ્રેટરની કચેરીએ ભરવાની વિગત:-

અરજી કરેલ તમામ વિગતોની ચકાસણી કરવામાં આવેલ છે તેમજ કોર્પોરેશનમાં અન્ય હેતુ માટે અરજદારે લોન માંગણી કરેલ નથી, જેની અત્રેના આસીસ્ટન મેનેજર દ્વારા ખાત્રી કરવામાં આવેલ છે, જે અમારા અભિપ્રાય મુજબ.....ના હેતુ માટે રૂ.....નું ધિરાણ મંજૂર કરવા ભલામણ છે.

સ્થળ:-

તારીખ:-

આસી.મેનેજર, નિગમ
(પ્રાયોજના વહીવટદારની કચેરી)

પ્રાયોજના વહીવટદાર/મદદનીશ કમિશ્નરશ્રી
(સહી-સિક્કો)

પત્રક -૧

કોર્પોરેશન તરફથી આદિજાતિ વ્યક્તિઓને સ્વરોજગારી તેમજ એન.એસ.ટી.એફ.ડી.સી ન્યુ દીલ્હીની યોજના હેઠળ ધીરવામાં આવતી વ્યક્તિગત લોન ફોર્મમાં નીચે મુજબની ભાગ-૧માં જણાવેલ શરતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે. તેમજ ભાગ-૨માં જણાવેલ વિગતો લોન મંજૂર થયા બાદ રજૂ કરવાની રહેશે,

શરતો અને પાત્રતા:-

(ભાગ-૧ની વિગતો અરજદારે લોન ફોર્મ ભરતા સમયે ધ્યાનમાં લઈ ફોર્મ સાથે રજૂ કરવાની રહેશે)

ભાગ-૧

- (૧) લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા ૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા ૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઈએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
- (૨) લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે
- (૩) લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- (૪) લાભાર્થીએ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાનો રહેશે. લોન મંજૂર થયેથી લોનની રકમ ના ૫ ટકા લાભાર્થી ફાળો ભરવાનો રહેશે તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.
- (૫) લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધિરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધિરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.
- (૬) લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઈ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઈ પણ યોજના હેઠળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઈ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહીં.
- (૭) પ્રોજેક્ટ કચેરીમાં મેળવેલ અરજીપત્રક જ સ્વીકારવામાં આવશે. અને અરજીપત્રક ભરીને તે જ કચેરીએ આપવાનું રહેશે.
- (૮) ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપૂર્ણ વિગતો સહ પ્રાયોજના વહીવટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે. જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ, યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત, લાભાર્થીનો અનુભવ, વીજળી જોડાણ વગેરે પેટા માહિતી પણ અરજી સાથે સામેલ કરવાની રહેશે.
- (૯) કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેક્ટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકું લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં કાયુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહીં.
- (૧૦) વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહીં.
- (૧૧) અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
- (૧૨) અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
- (૧૩) લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
- (૧૪) અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહીં.

ભાગ-૨ની વિગતો અરજદારે લોન મંજૂર થયા બાદ અરજદારે રજૂ કરવાની રહેશે.

ભાગ-૨

- (૧) અરજદારે લોન માંગણી મુજબ લોન મંજૂર થયા બાદ કોર્પોરેશનના નિયમોનુસાર જે-તે યોજનાના નિયત કરેલ એડવાન્સ ચેક આપવાના રહેશે.(સ્વરોજગારી, એનએસટીએફડીસીની યોજના માટે નંગ-૨૦ એડવાન્સ ચેક તેમજ વિદેશ અભ્યાસ માટે નંગ-૬૦ એડવાન્સ ચેક, પાયલોટ તાલીમની યોજના માટે નંગ-૧૪૪ એડવાન્સ ચેક)

(૨) લાભાર્થીએ ધિરાણની રકમથી બમણી મિલકત ધરાવતાં સરખી રકમના બે જામીનદારો રજુ કરવાના રહેશે. તેમજ જામીનદારોએ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ ઉપર વસુલાત તથા જામીન રહેવા અંગેની બાંહેધરી આપવાની રહેશે. તથા અરજદારની લોન મંજૂર થયેથી કોર્પોરેશનનો બોજો અંગેની નોંધનું પ્રમાણપત્ર અત્રે રજૂ થયા બાદ નાણાં છુટા કરવામા આવશે તમામ લોનની રકમ અત્રે ઉપલબ્ધ ગ્રાંટના પ્રમાણે મંજૂર કરવામાં આવશે

(૩) અરજદારે લાભાર્થી ફાળો, કરજખત, ગીરોખત, બોજાનોંધણીનું પ્રમાણપત્ર લોન મંજૂર થયા બાદ એક માસની સમયમર્યાદામાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આપ લોન લેવા માંગતા નથી તેમ માની મંજૂર થયેલ ધિરાણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

વકીલ સહાયના લાભ મેળવવા માટે શરતો અને પુરાવાઓ (કોષ્ટક-૧ માં જણાવ્યા મુજબ)

કાયદાના સ્નાતકોને સ્ટાઇપેન્ડ મેળવવા માટે અરજદાર કાયદાનો સ્નાતક હોવો જોઈએ. તેમજ અરજદારે જે સિનીયર વકીલના હાથ નીચે પ્રેક્ટીસ કરતાં હોય તે સિનીયર વકીલની નામ-સરનામાં, ટેલીફોન નંબર સહિત વિગત રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત અરજદારનો બાર કાઉન્સિલનો રજીસ્ટ્રેશન નંબર રજૂ કરવાનો રહેશે. અરજદારે સિનીયર વકીલના હાથ નીચે ત્રણ વર્ષ સુધી પ્રેક્ટીસ કર્યાના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. તથા સનદ મેળવ્યાની અંદર બે વર્ષમાં અરજી કરવાની રહેશે અન્યથા સ્ટાઇપેન્ડ મેળવવાને પાત્ર ગણાશે નહીં. જુ, વકીલને પ્રથમ માસ રૂપિયા ૧૦૦૦/- લેખે બાર માસના રૂપિયા ૧૨૦૦૦/- બીજા વર્ષના પ્રતિમાસના રૂપિયા ૮૦૦/- પ્રમાણે કુલ રૂપિયા ૯૬૦૦/- ત્રીજા વર્ષમાં પ્રતિ માસના રૂપિયા ૬૦૦/- લેખે ૭૨૦૦/- મળી કુલ ૨૮૮૦૦/- મળવા પાત્ર રહેશે સીની, વકીલને પ્રતિ માસ રૂપિયા ૫૦૦/- લેખે ત્રણ વર્ષના રૂપિયા ૧૮૦૦૦/- મળવા પાત્ર રહેશે સીનીયર વકીલ ને પ્રેક્ટીસ નો ૭ વર્ષ નો અનુભવ હોવો જરૂરી છે. જુ. વકીલ તેમજ સી, વકીલને સહાય (સ્ટાઇપેન્ડ) મંજૂર થયેથી રૂ ૨૦- સ્ટેમ્પ પેપર પર એકરાર નામુ રજુ કરવાનું રહેશે ફોર્મમાં દર્શાવેલ ક્રમ-૧માં (અ) થી (ઇ) સુધીની સંપૂર્ણ વિગતો તેમજ કોષ્ટક-૧ અરજદારે ભરવાની રહેશે.

(વિદેશ અભ્યાસ તેમજ પાયલોટ તાલીમની લોનની માટે શરતો અને પુરાવાઓ (કોષ્ટક-૨માં જણાવ્યા મુજબ)

- ૧) અરજદારે સરકાર માન્ય વેલ્યુઅર પાસેથી પોતાની મિલકત અંગેનો વેલ્યુએશન રિપોર્ટ તેમજ રજૂ કરેલ બન્ને જામીનદારના પણ વેલ્યુએશન રિપોર્ટ સાથે મિલકતના જરૂરી પૂરાવા રજૂ કરવાના રહેશે.
- ૨) અરજી ફોર્મ સાથે વિદેશની કોલેજમાં પ્રવેશ મેળવ્યા અંગેનો આધાર(એડમીશન લેટર), પ્લેનની ટિકીટ, વિઝાની નકલ, કોલેજમાં ફી ભર્યાની રસીદ તેમજ પાસપોર્ટની નકલ રજૂ કરવાની રહેશે. (વિદેશ અભ્યાસ તેમજ પાયલોટ લોનમાં આવક મર્યાદા નથી)
- ૩) અરજદારે આર્થિક સધ્ધરતા અંગે છેલ્લા એક વર્ષનું બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.
- ૪) ફોર્મમાં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો, કોષ્ટક-૨ અરજદારે ભરવાની રહેશે.
- ૫) અરજદારે વિદેશ અભ્યાસ તેમજ પાયલોટ તાલીમની લોન માટે ચેકલિસ્ટ રજૂ કરવાનું રહેશે.

પોલેટ્રી ફાર્મ/તબેલા યોજનાનો લાભ મેળવવા માટે શરતો અને પુરાવાઓ

- ૧) અરજદારે મરઘા પાલન/પશુપાલન અંગેની તાલીમ મેળવ્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- ૨) અરજદારે નિયત નમૂના-૧૬ મુજબ તલાટી-કમ-મંત્રી પાસેથી પાણીની વ્યવસ્થા તેમજ વીજ જોડાણ અંગેનું પ્રમાણપત્ર/પુરાવા રજૂ કરવાનું રહેશે.
- ૩) અરજદારે કોર્પોરેશનના નિયત નમૂના મુજબ બાંધકામ કરવાનું રહેશે. તેમજ બાંધકામ થયેથી થયેલ બાંધકામ મુજબ પૂરાવાના આધારે લોનના નાણાં તબકાવાર છૂટા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- ૪) ફોર્મમાં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.

ઉપરોક્ત જણાવેલ તમામ શરતો અને વિગતો મેં કાળજીપૂર્વક વાંચી છે. અને આ તમામ શરતોના સ્વીકાર સાથે લોન મંજૂર કરવા વિનંતી કરું છું.

સાક્ષીની સહી

અરજદારની સહી અથવા અંગુઠાનું નિશાન

.....
.....

નામ:-

સરનામું:-